

-:: પ્રેસ નોટ ::-

**જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા “ગીર સાવજ” યણા અને ઘઉં
(સર્ટીફાઈડ/ટ્રુથકુલ) બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી બાબત
(તા.૧૭-૦૯-૨૦૨૨ થી તા.૨૬-૦૯-૨૦૨૨)**

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ૨વી-૨૦૨૨-૨૩ ઋતુમાં વાવેતર માટે યણાની GJG-3, GG-5 અને GJG-6 અને ઘઉંની Lok-1 અને GW-496 જાતોના સર્ટીફાઈડ/ટ્રુથકુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in ઉપર તા.૧૭-૦૯-૨૦૨૨ થી તા.૨૬-૦૯-૨૦૨૨ સુધી કરવાની રહેશે. ખેડૂત મિત્રોએ બંને પાક માંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાત નું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂતમિત્રોની જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. આગામી ૨વી ઋતુમાં યણા અને ઘઉંના બિયારણનું વિતરણ યુનિવર્સિટીના કેન્દ્રો જેવા કે મેગાસીડ, જૂનાગઢ; કેવીકે, અમરેલી; કેવીકે, ખાપટ; કેવીકે, જામનગર; કેવીકે, મોરબી; કેવીકે, તરઘડીયા અને કેવીકે, નાના કાન્ધાસર ખાતેથી કરવામાં આવનાર છે. ખેડૂતોએ પોતાની માંગણી મુજબના પાક અને જાતનું બિયારણ ક્યાંથી મેળવવાનું રહેશે તેની જાણ SMS માં કરવામાં આવશે. ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ યણા અથવા ઘઉંની જાતનું બિયારણ તે જાતનો જથ્થો જેતે કેન્દ્ર ખાતે ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ ૧૦ બેગ (યણામાં ૨૫૦ કિ.ગ્રા. અને ઘઉંમાં ૪૦૦ કિ.ગ્રા.) સુધી મળવાપાત્ર થશે. આગામી ૨વી ઋતુમાં સર્ટીફાઈડ/ટ્રુથકુલ બિયારણના વિતરણમાં સબસીડી સહાયની જોગવાઈ નથી. વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો. તેમજ બિયારણ વિતરણ સંબંધીત માહિતી માટે જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in જોતા રહેવું.

આ ઉપરાંત, આગામી ૨વી ઋતુમાં ઘઉંમાં GW-451 અને GJW-463 નું વિતરણ ઓનલાઈન અરજી સિવાય વહેલાતે પહેલાના ધોરણે વેચાણ તારીખ નક્કી થયેથી કરવામાં આવનાર છે. GJW-463 નું વિતરણ કેવીકે, અમરેલી અને કેવીકે, જામનગર ખાતેથી, જ્યારે GW-451નું વિતરણ મેગસીડ, જૂનાગઢ; કેવીકે, ખાપટ અને કેવીકે, અમરેલી ખાતેથી થશે. તો ઘઉંની આ બે જાતોનું બિયારણ લેવા માંગતા ખેડૂતોએ ઉપરોક્ત દર્શાવેલ કેન્દ્રોનો સંપર્ક કરવો. વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૮૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવો.

સ્થળ :- જૂનાગઢ

તારીખ :- ૧૨/૦૯/૨૦૨૨

પ્રાધ્યાપક અને વડા

બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ

કૃષિ મહાવિદ્યાલય

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

જૂનાગઢ

રવી-૨૦૨૨-૨૩ઋતુ માટે યુનિવર્સિટી ઉત્પાદિત ચણા અને ઘઉંના સર્ટીફાઈડ/ટ્રુથફુલ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી માટેની શરતો

- (૧) ખાતેદાર ખેડૂતોના "૮-(અ)"માં નોંધાયેલ નામો પૈકી કોઈ પણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધારકાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી જ અરજીઓ રદ કરવામાં આવશે.
- (૨) ચણા અને ઘઉંના બિયારણની નોંધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે.
- (૩) આગામી રવી-૨૦૨૨-૨૩ઋતુમાં ખેડૂતમિત્રોને વાવેતર માટે ચણામાં GJG-3, GG-5 અને GJG-6 અને ઘઉંમાં LOK-1 અને GW-496 જાતોનું સર્ટીફાઈડ/ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોઈ ખેડૂતમિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈ પણ એક પાકની એક જાતના બિયારણ માટે અરજી કરી શકશે. જે જાત માટે અરજી કરી હશે તે જ જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રોએ અરજીમાં જે જાત માટે ઓનલાઈન અરજી કરી હશે તે જ જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો જે તે કેન્દ્ર ખાતે ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ ૧૦ બેગ (ચણામાં ૨૫૦ કિ.ગ્રા. અને ઘઉંમાં ૪૦૦ કિ.ગ્રા.) સુધી મળવાપાત્ર થશે. આગામી રવી ઋતુમાં સર્ટીફાઈડ/ટ્રુથફુલ બિયારણના વિતરણમાં સબસીડી સહાયની જોગવાઈ નથી.
- (૪) ખેડૂતમિત્રોની જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. ચણા અને ઘઉંના બિયારણનું વિતરણ યુનિવર્સિટીના કેન્દ્રો જેવા કે મેગાસીડ, જૂનાગઢ; કેવીકે, અમરેલી; કેવીકે, ખાપટ; કેવીકે, જામનગર; કેવીકે, મોરબી; કેવીકે, તરઘડીયા અને કેવીકે, નાના કાન્ધાસર ખાતેથી કરવામાં આવનાર છે. ખેડૂતોએ પોતાની માંગણી મુજબના પાક અને જાતનું બિયારણ ક્યાંથી મેળવવાનું રહેશે તેની જાણ SMS માં કરવામાં આવશે.
- (૫) ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્ટ કાઢીને તેમાં અરજદારે સહી કરવી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે.
- (૬) બિયારણ ખરીદી માટે ખેડૂતમિત્રોને ફાળવવામાં આવેલ તારીખો એ જ બિયારણ મળશે. એટલે કે ખેડૂતમિત્રોને જે તારીખો બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવે તે તારીખો એ જ લઈ જવાનું રહેશે. અન્યથા તે તારીખ બાદ ખેડૂતમિત્રની અરજી અમાન્ય ગણવામાં આવશે અને તે ખેડૂતને ત્યારબાદ બિયારણ ખરીદીનો લાભ આપવામાં આવશે નહીં.
- (૭) બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમથી રેન્ડમાઈઝેશન કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે. પાછળથી કોઈ પણ દાવો ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
- (૮) અરજીમાં ચણા અને ઘઉંની જાતની નોંધણી એક વાર થઈ ગયા પછી તેમાં સુધારો થઈ શકશે નહિ. જ્યારે તે સિવાયની ભૂલ રહી ગઈ હશે તો તે અરજી કરવાના સમયગાળા દરમિયાન સુધારી શકશે.
- (૯) જે ખેડૂતમિત્રોએ રવી-૨૦૨૨-૨૩ઋતુમાં વાવેતર માટે ઓનલાઈન અરજી કરી હોય તેઓએ જ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in પર બિયારણ વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી માટે જોતા રહેવું.
- (૧૦) આઉપરાંત, આગામી રવી ઋતુમાં ઘઉંમાં GW-451 અને GJW-463 નું વિતરણ ઓનલાઈન અરજી સિવાય વહેલા તે પહેલાના ધોરણે વેચાણ તારીખ નક્કી થયેથી કરવામાં આવનાર છે. GJW-463 નું વિતરણ કેવીકે, અમરેલી અને કેવીકે, જામનગર ખાતેથી, જ્યારે GW-451 નું વિતરણ મેગાસીડ, જૂનાગઢ; કેવીકે, ખાપટ અને કેવીકે, અમરેલી ખાતેથી થશે.

આથી હું લખી આપું છું કે ઉપરોક્ત અરજી મેં જાતે કરેલ છે અને ઉપર મુજબની શરતો મેં વાંચેલ છે. બિયારણ લેવા સમયે અરજી તથા અરજીમાં દર્શાવેલ આધારોની અસલ નકલ રજૂ કરવા હું બંધાવું છું.

અરજી કરનારની સહી